



સપ્ટેમ્બર 22 થી સીટી ઓફ બ્રેમ્પટનની પસંદગીની સગવડોમાં રસીકરણના પુરાવાની જરૂર પડશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 17, 2021) – ચોક્કસ સગવડોમાં પ્રવેશવા રસીકરણનો પુરાવો હોવો જરૂરી હોવાના ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોના [નિયમનો](#) અને [માર્ગદર્શન](#) અનુસાર, સીટી ઓફ બ્રેમ્પટનને બુધવાર, સપ્ટેમ્બર 22 થી આનંદપ્રમોદ, રમતો, સાંસ્કૃતિક અને મનોરંજનલક્ષી સગવડો સહિતની પસંદ કરેલી સીટીની માલિકીની સર્વિસીસમાં પ્રવેશવા રસીકરણના પુરાવાની જરૂર પડશે. ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોના નિયમનો પ્રમાણે મુક્તિ આપવામાં આવશે.

પ્રોવિન્સના નિયમન અને માર્ગરેખાઓ પ્રમાણે, રસીના પ્રમાણપત્રોની જરૂરિયાત ઈનડોર વિસ્તારોમાં પડશે, જેમ કે:

- વોટરપાર્ક્સ અને અંગત શારીરિક ફિટનેસ ટ્રેઇનર્સ સહિત, રમતો અને મનોરંજનલક્ષી તંદુરસ્તી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતી સગવડો
- દર્શકો આયોજનો જોતા હોય તેવી સગવડો
- કોન્ફરન્સ સેન્ટર્સ કે કન્વેન્શન સેન્ટર્સ સહિતના, મીટિંગ અને ઈવેન્ટ પ્લેસીસ
- કન્સર્ટ સ્થળો, થીયેટર્સ અને સિનેમા
- કેસિનો, બિંગો હોલ્સ અને અન્ય ગેમિંગ એસ્ટાબ્લિશમેન્ટ્સ
- રેસ્ટોરન્ટ્સ, બાર્સ અને અન્ય ખાદ્ય પદાર્થો કે પીણાં વેચતી એસ્ટાબ્લિશમેન્ટ્સ
- નાઈટક્લબ્સ, રેસ્ટોન્ક્લબ્સ અને અન્ય સમાન એસ્ટાબ્લિશમેન્ટ્સ સહિત, ઈનડોર અને આઉટડોર બંને વિસ્તારોમાંની ખાદ્ય પદાર્થો કે પીણાં વેચતી એસ્ટાબ્લિશમેન્ટ્સ જ્યાં નૃત્ય સગવડો પૂરી પાડવામાં આવતી હોય

રસીકરણના પુરાવાની જરૂર નીચેના સ્થળોએ પડશે નહીં:

- લાઈબ્રેરી, કોર્ટ હાઉસ અથવા ટેક્સ બિલ્સ ચૂકવવા કે ઈમારતની પરમીટ્સ મેળવવી જેવી અનિવાર્ય શહેરી સર્વિસીસમાં પ્રવેશવું
- સંગઠિત રમતમાં સહભાગી થતા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, જોકે માતા-પિતાઓ અને વાલીઓ સહિતના દર્શકોએ પ્રવેશવા રસીકરણનો પુરાવો દેખાડવો રહ્યો
- ડે કેમ્પ્સ, બાળ સંભાળ અને સામાજિક સેવાઓ માટે ઉપયોગમાં લેવાતી ભાડાની જગ્યાઓ
- લગ્ન સમારંભ, ધાર્મિક સેવાઓ/વિધિઓ અને અંતિમ વિધિઓ (માત્ર સમારંભ)
- ખાનગી નિવાસોમાં હળવું-મળવું
- આઉટડોર આયોજનો

રસી પ્રમાણપત્ર નિયમનોનું અમલીકરણ કરવામાં ધંધાઓને સહાયતા કરવા, ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયો પાસે [ધંધાઓ માટે માર્ગદર્શન](#) સંસાધનો ઉપલબ્ધ છે. સંપૂર્ણ વિગતો [ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોના નિયમનો](#)માં જોઈ શકાય છે.

શહેરની સગવડોમાં રસીના પુરાવાની સ્વીકાર્ય પદ્ધતિઓ

સીટી ઓફ બ્રેમ્પટનની સગવડમાં મુલાકાત લેતી વખતે રસીકરણ સ્થિતિના પુરાવાની નીચેની પદ્ધતિઓની સાથે અંગત ઓળખનો વધારાનો એક નમૂનો સ્વીકારવામાં આવશે:



1. પ્રૂફ ઓફ ઈમ્યુનાઈઝેશન વેક્સિન રિસિપ્ટ (રસીકરણ રસીની રસીદનો પુરાવો): આ પ્રોવિન્સના ઓનલાઈન [COVID-19 વેક્સિન પોર્ટલ](#) પરથી, અથવા પ્રોવિન્સની વેક્સિન બુકિંગ લાઈનને 1.833.943.3900 નંબર પર કોલ કરીને મેળવી શકાય છે.

2. ઓન્ટેરિયોની એનહાન્સ્ડ ડિજિટલ વેક્સિન રિસિપ્ટ: ઓન્ટેરિયો ગવર્નમેન્ટ આ વિકલ્પ ઓક્ટોબર 2021 માં રજૂ કરી રહ્યું છે. ડિજિટલ વેક્સિન રિસિપ્ટ તમારા મોબાઈલ ફોન પર રાખી શકાય છે અને તમને રસી મૂકવામાં આવી હોવાનું દેખાડવા સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય છે. આ વિકલ્પના સંબંધમાં વધુ માહિતી ઉપલબ્ધ થાય એટલે પૂરી પાડવામાં આવશે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca